

એકલ ભાડુઆત માટે લૉકર ભાડે આપવાનો કરાર

શાખાનું નામ		શાખાનો કોડ		લૉકર સીરિઝ અને નંબર		આવી નં.	
લૉકર સાઈઝ		શાખા શહેર શ્રેણી		સંચાલનનો પ્રકાર :			
ભાડુ વસૂલ કરવા માટે ખાતું		ગ્રાહક આઈડી		માફી % :	પ્રબંધિત ગ્રાહક	☐ પહેલું લૉકર ☐ બીજું લૉકર	ભાડુઆતનો ફોટો
રેક દર		ભાડાનો દર		માફીનું કારણ :			

એચડીએફસી બેંક લિમિટેડ, _____ (શાખાનું નામ) (હવે પછી અહીં “બેંક” તરીકે ઉલ્લેખ કરાશે)

(ભાડુઆતના નામ અને સરનામા)

_____ને (જેને હવે પછી અહીં ભાડુઆત તરીકે ઉલ્લેખ કરાશે) બેંકનું લૉકર નં. _____ (“લૉકર”) વર્ષ _____ માટે આજરોજથી અહીં જણાવેલ નિયમો અને શરતો અનુસાર નિર્ધારિત કરેલ હોય એ સિવાય પ્રતિ વર્ષ રૂ. _____ ના (અગાઉથી ચૂકવવાપાત્ર) ભાડાં પર તેમ જ તેને લગતા બેંકના અહીં પાછળ જણાવેલા વખતો વખત લાગુ નિયમો અને શરતોને આધીન આપવા સહમત થાય છે અને ભાડુઆત તે ભાડે લેવા સહમત થાય છે. ભાડુઆત લૉકરના ભાડાંની વસૂલી પેટે અહીં ઉપર જણાવેલ બેંક અકાઉન્ટ દર વર્ષે એડવાન્સમાં ડેબિટ કરવા બેંકને અધિકૃતતા આપે છે. ભાડુઆત ત્યારબાદ બેંકની મુનસફીએ તેમ જ બેંકદ્વારા વખતો વખત નિર્ધારિત કરવામાં આવે એ દર અને મુદત તથા નિયમો અને શરતો અનુસાર આગળ ચાલુ રાખી શકે છે.

નામાંકન : ☐ હા (જો હા, તો કૃપા કરી નીચે નામાંકનની વિગતો ભરો) / **જો લાગુ ન હોય તો છેકી નાખો**

એકલ ભાડુઆત માટે નોમિનેશન ફોર્મેટ (ફોર્મ એસએલ૧) (ફકરો 1.5.2 (i) (a) અનુસાર)

બેન્કિંગ રેગ્યુલેશન અક્ટ, 1949ની કલમ 45ZE અને બેન્કિંગ કંપનીઝ (નોમિનેશન) રુલ્સ, 1985ના નિયમ 4(1) અંતર્ગત લૉકર સંદર્ભે એકલ ભાડુઆતે કરવાનું રહેતું નોમિનેશન (નામાંકન).

હું, _____ (નામ અને સરનામું)

_____ નીચેની વ્યક્તિને નોમિનેટ કરું છું જેને મારા/સગીરના મૃત્યુ થવાના કિસ્સામાં _____

(લૉકર જ્યાં આવેલું હોય એ શાખા/કાર્યાલયનું નામ અને સરનામું)

લૉકરની પહોંચ તેમ જ લૉકરમાં રહેલ વસ્તુઓ કાઢવાની સ્વતંત્રતા આપવામાં આવી શકે છે, જેની વિગતો નીચે આપવામાં આવી છે.

નામાંકન કરેલ વ્યક્તિની વિગતો			
નામ, સરનામું અને સંપર્ક નં.	ભાડુઆત સાથેનો સંબંધ, જો કોઈ હોય તો	ઉંમર	નામાંકન કરેલ વ્યક્તિની જન્મ તારીખ (સગીર હોય તો)

પાલકની વિગતો (જો નામાંકન કરેલ વ્યક્તિ સગીર હોય તો)

(નામ અને સરનામું)

સાક્ષીઓનું/ના નામ(મો), સરનામું(મા) અને સહી(ઓ):

@ માત્ર અંગૂઠાની છાપ/માતૃભાષામાં ઘોષણા કરવાના કિસ્સામાં.

નામાંકન: ☐ ના, હું ઘોષિત કરું છું કે હું નામાંકન કરવા નથી ઇચ્છતો.

મેં પાછળના પાના પર જણાવેલા નિયમો અને શરતો તેમ જ નિયમો વાંચ્યા અને સમજી લીધા છે તથા તેનું પાલન કરવા અને બંધનકર્તા રહેવા સહમત થાઉં છું. લૉકર નં. _____ માટે આવી નં. _____ આ સાથે સીલબંધ રીતે બેંકદ્વારા ભાડુઆત ને સોંપવામાં આવી છે, જે મળ્યાની પહોંચ ભાડુઆત દ્વારા આપવામાં આવી છે.

આ કરારની વિગતો તથા નિયમો અને શરતો સહિત રુલ્સ જે પાછળના પાને જણાવેલા છે તે ભાડુઆત દ્વારા વાંચવામાં અને સમજી લેવામાં આવ્યાં છે અને પાછળના પાને આપેલા દરેક લખાણ સાથે તેઓ સહમત છે તથા તેનું પાલન કરવા બંધનકર્તા રહેવા માટે સહમત થાય છે. આ કરાર તેમ જ પાછળના પાને વિસ્તૃત જણાવેલા નિયમો અને શરતોની પ્રત ભાડુઆત ને પ્રાપ્ત થઈ છે.

લૉકર માટે અરજી કરનારનું નામ અને સહી

એચડીએફસી બેંક લિ. વતી (અધિકૃત સહીકર્તા)

તારીખ : _____ સ્થળ : _____

નોંધ : કૃપા કરી પત્રકમાં સહી કરતા પહેલા બધા જ સુસંગત વિભાગોમાં તમને સંતોષકારક રીતે વિગતો જણાવી હોય તે સુનિશ્ચિત કરશો.

નિયમો અને શરતો

1. સેફ ડિપોઝિટ વોલ્ટ રવિવાર અને બેંકમાં રજાના દિવસો સિવાય દરરોજ કામકાજના સમય દરમિયાન ખુલ્લું રહેશે. આ દિવસોએ અને નિર્દિષ્ટ સમયે ભાડુઆત તેનો ઉપયોગ કરી શકે છે.
2. લૉકરના ઉપયોગ માટેનાં ઉપર જણાવેલા સમયમાં ફેરફાર કરવાની બેંકને છૂટ રહેશે તથા બેંકને યોગ્ય લાગે તે શરતો ઉમેરી શકે છે અને આ માટેની સૂચના ભાડુઆત ને આપશે અને ભાડુઆત તેને બંધનકર્તા રહેશે.
3. ભાડુઆત લૉકરના ઉપયોગના અર્થ અને ભાડુઆત અથવા તેના/તેણીના એજન્ટ (જો નિમણૂક કરેલ હોય તો) ની ઓળખ સંબંધિત નિયમો અને નિયમનો જે બેંક દ્વારા વખતો વખત ભલામણ કરવામાં આવી શકે તેનું પાલન કરશે.
5. જો ભાડુઆત લૉકરના સંચાલન માટે કોઈ અધિકૃત એજન્ટ નિયુક્ત કરવા ઇચ્છતા હોય તો ભાડુઆત એ એવા એજન્ટના પક્ષમાં પાવર ઓફ એટર્ની કરવાની રહેશે અને/અથવા બેંક દ્વારા આવશ્યક કરવામાં આવે તે અન્ય દસ્તાવેજો તૈયાર કરાવવાના રહેશે તેમ જ આ એજન્ટ વખતો વખત બેંક દ્વારા નિર્ધારિત કરાતા નિયમો અને નિયમનોનું પાલન કરવા બંધનકર્તા રહેશે. જોકે, આવા એજન્ટને લૉકર સુધી પહોંચેને મંજૂરી આપવાથી થતા નુકસાન માટે બેંકને કોઈપણ સમયે જવાબદાર નહીં ઠેરવવામાં આવે કે ન તો બેંક કોઈ ખર્ચા માટે ઉત્તરદાયી બને અને ભાડુઆત એ બેંકને નુકસાન ભરપાઈ કરવાનું રહેશે તથા લૉકરના સંચાલન સંદર્ભે આવા એજન્ટના કાર્યો માટે બેંકની સામે કરેલા દરક દાવા અને માંગો પર બેંકને નુકસાન ભરપાઈ કરવાનું રહેશે અને તેને નુકસાનથી સુરક્ષિત રાખવાની રહેશે. બેંક તેના નિર્ણય દ્વારા આવા એજન્ટને લૉકર સુધી પહોંચ આપવાની મનાઈ કરી શકે છે.
6. ભાડુઆતનું મુત્યુ થવાના કિસ્સામાં કાયદેસરના વારસો/નોમિનીઓ લૉકરનો ઉપયોગ બેંક દ્વારા નક્કી કરાય તે નિયમો અને શરતો અનુસાર કરવા અથવા લૉકર તેમાં રહેલી વસ્તુઓ કાઢી લઈને તેની ચાવી બેંકને પાછી સોંપીને લૉકર સરન્ડર કરવા હકદાર રહેશે. નામાંકન કરેલ વ્યક્તિ, કાનૂની વારસ ઉપરાંત અન્ય કોઈના દ્વારા કોઈ દાવો કરવાના કિસ્સામાં બેંકને જવાબદાર નહીં ઠેરવી શકાય. કોઈ ભાડુઆત દ્વારા લૉકરનો સામાન મેળવવા, કોઈ વ્યક્તિને બેંકના નામાંકનના નિયમો અનુસાર નામાંકન કરવા પર સામાનને નામાંકન દિશા-નિર્દેશો અનુસાર વિતરિત કરવામાં આવશે.
7. ભાડુઆત આવશ્યકતા જણાવવા પર લૉકરની સ્થિતિ તેમ જ દશાની તપાસ કરવા અને કોઈપણ સમારકામ/સમાયોજન કરવા તેમ જ લૉકરનો ઉપયોગ સંબંધિત નિયમો અને શરતો અનુસાર કરાય છે તે સુનિશ્ચિત કરવા માટે બેંકને લૉકરની પહોંચ પૂરી પાડશે. પરંતુ બેંક તેમાં રહેલા સામાનની માહિતી હોવા અથવા તેની માટે જવાબદાર નહીં માનવામાં આવે.
8. સહમતી આપેલ દરેક ભાડાં ચુસ્તપણે અગાઉથી અથવા અગાઉની મુદતના છેલ્લા દિવસે આવતી મુદત માટે ચૂકવવાપાત્ર રહે છે અને બેંક લૉકરની પહોંચ પૂરી પાડવાથી ઇનકાર કરવાનો અધિકાર પોતાની પાસે અનાધિત રાખે છે. જો કોઈ ભાડું, માગણી કરાયેલ અથવા ન કરાયેલ કે પછી વધારેલું ભાડું ચૂકવવામાં ન આવે તો બેંક આ ભાડાંની રકમ ભાડુઆતના બેંકસાથેના ખાતામાં ભાડુઆતોને વધુ કોઈ સંદર્ભ વિના ઉધારી શકે છે (પરંતુ આ કરવા બાદ્ય નહીં રહે) અને જેઓ આ દ્વારા જ્યાં પણ ભાડું પાડી ગયું અને બેંકને ચૂકવવાપાત્ર હોય ત્યાં તેનું/તેણીનું ખાતું ઉધારવા (ડેબિટ કરવા) બેંકને અધિકૃતતા આપે છે. બાકી રહેલું ભાડું બેંકને પૂરેપૂરું ચૂકવવામાં ન આવે ત્યાં સુધી 18% દરે વ્યાજ સહિત એકસાથે ચૂકવવાપાત્ર રહેશે.
9. લૉકરના ભાડાં પર વખતો વખત લાગુ થાય તેમ કરવેરા લાગુ રહેશે.
10. બેંક તેની સંપૂર્ણ મુનસફીએ ભાડાંમાં સુધારો/વધારો કરવા હંમેશા હકદાર રહેશે અને ભાડુઆત બેંક દ્વારા તે નક્કી કરવામાં આવે એ તારીખથી ચૂકવવા માટે જવાબદાર રહેશે.
11. ભાડુઆતે ભાડે રાખેલ લૉકરની ગ્રાહકની ચાવી તેને/તેણીને આપી દેવામાં આવશે. આ ચાવી હરહંમેશ બેંકની મિલકત રહેશે. માસ્ટર ચાવી હંમેશા બેંક પાસે જ રહેશે. ભાડુઆત એ સમજે છે કે લૉકર બંને ચાવીઓના ઉપયોગથી જ ખોલી શકાય છે નહીં કે કોઈ એક ચાવીના ઉપયોગથી. અને લૉકર બંધ કરવા માસ્ટર કીની જરૂર નથી પડતી. ભાડુઆતને માત્ર ગ્રાહકની ચાવી દ્વારા જ લૉકર ખોલવાની પરવાનગી છે અને બેંક દ્વારા પૂરી પડાયેલ ગ્રાહક ચાવી સિવાયની અન્ય કોઈ ચાવી દ્વારા લૉકરનું સંચાલન કરવાની પરવાનગી નહીં રહે.
12. જો ભાડુઆત દ્વારા ગ્રાહક ચાવી ખોવાઈ જાય તો તેમણે ચાવી ખોવાઈ ગયાની સૂચના બેંકની વિના વિલંબે લેખિતમાં આપવાની રહેશે તથા ઇન્ડેક્સિંગ સહિત એક્સાઈઝર/પોલીસ ફરિયાદની પહોંચ બેંકને આપીને ભાડુઆતની લેખિત અરજી કરવા પર નવી ચાવી તેને આપવામાં આવી શકે છે. બ્લેક ઓપન પ્રક્રિયા માટે બંધાં જ ભાડુઆત લૉકર બ્રાન્ચમાં હાજર હોવા જરૂરી છે. લૉકર ખોલવા/તોડવા માટે, ખોવાઈ ગયેલી ચાવી સામે નવી ચાવી લેવા તથા લૉક બદલવા માટે લાગતો બધો જ ચાર્જ ભાડુઆતે ચૂકવવાપાત્ર રહેશે. લૉકર, લૉક અથવા ચાવીને જરૂરી બધું જ સમારકામ વિશેષતઃ બેંક દ્વારા નિયુક્ત કાર્યકર દ્વારા કરવામાં આવશે.
13. ભાડુઆતને તેના/તેણીના લૉકરની ગ્રાહક ચાવી સુરક્ષિત જગ્યાએ રાખવા ચેતવવામાં આવે છે અને અન્ય કોઈ વ્યક્તિને તેના/તેણીના લૉકરનો નંબર અને/અથવા તેનો પાસવર્ડ (જો આપ્યો હોય તો) અન્ય કોઈ વ્યક્તિને ન જણાવવા તેમ જ ગ્રાહક ચાવી તેના/તેણીના અધિકૃત એજન્ટ (જો નિયુક્ત કરેલ હોય તો) સિવાય અન્ય કોઈ વ્યક્તિને ન જણાવવા કહેવામાં આવે છે. ભાડુઆત ગ્રાહક ચાવી મળી ગયાની પહોંચ પૂરી પાડશે અને આ કારાર રદ થવા પર તે બેંકને સોંપી દેશે.
14. બંધાં જ ભાડુઆતોએ લૉકર સરન્ડર કરવા લૉકર શાખામાં પ્રત્યક્ષ હાજર રહેવું ફરજિયાત છે.
15. ભાડુઆત લૉકરમાં કોઈ મિલકત અધિકાર નહીં ધરાવે પરંતુ આ કારાર ચાલુ રહે ત્યાં સુધી તેમ જ તેમાં જણાવેલા નિયમો અને શરતો અનુસાર માત્ર તેના ઉપભોક્તાનો સવિશેષ અધિકાર અને તેની પહોંચ ધરાવે છે. ભાડુઆત લૉકર અથવા તેનો કોઈ ભાગ ફાળવશે, હસ્તાંતર કરશે અથવા પેટાં ભાડે નહીં આપે કે ન તો તેનો ઉપયોગ દસ્તાવેજો, ઘરેણાં અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ જમા કરવા સિવાયના અન્ય હેતુ માટે કરવાની પરવાનગી નહીં આપે તેમ જ આનો ઉપયોગ કોઈ વિસ્ફોટક અથવા વિનાશક અથવા ગુનાહિત સ્વરૂપની અથવા પ્રકારની કે જે બેંકના મતાનુસાર અડચણરૂપ બને/બની શકે તેવી વસ્તુ અથવા મિલકત જમા કરવા માટે નહીં કરે. ભાડુઆત દ્વારા આ જોગવાઈથી વિપરિત લૉકરનો ઉપયોગ કરવા પર થતા કોઈ ખર્ચા, માગણી, દાવા, નુકસાન, હાનિ, લાગત સામે બેંકને ઇન્ડેક્સિંગ કરશે. ભાડુઆત બેંક દ્વારા જયારે પણ આવશ્યક જણાય ત્યારે તેને ઉપરોક્ત શરતનું પાલન કરવામાં આવે છે તે ખાતરી કરવા લૉકરનો સામાન ચકાસવાની પરવાનગી આપે છે.
16. અન્ય ઉપાયો માટે પૂર્વાગ્રહ રાખ્યા વિના કે જે બેંક ભાડુઆત સામે ધરાવી શકે, લૉકરના ઉપયોગ માટેનાં ભાડુઆતના બંધાં જ અધિકારો બેંકના પોતાના વિકલ્પે જો અગર ભાડું માગણી કરેલ અથવા ન કરેલ અને અન્ય કોઈ ચાર્જિસ પાડેલા અને ચૂકવવાપાત્ર ચૂકવવામાં ન આવે, અથવા અહીં જણાવેલી કોઈપણ શરતનું ભાડુઆત દ્વારા ઉલ્લંઘન કરવા પર રદ કરવામાં આવી શકે છે અને બેંક તેની મરજી મુજબ ભાડુઆતના છેલ્લા નોંધ કરાયેલા સરનામા પર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ત્રીસ દિવસ અગાઉ લેખિત સૂચના મોકલીને લૉકર તોડીને ખોલી શકે છે અને તેમાં રહેલ બધો જ અથવા કોઈપણ સામાન જાહેર હરાજ દ્વારા અથવા ખાનગી સંધિ દ્વારા વેચીને બાકી રહેલ ભાડું અને/અથવા અન્ય ચાર્જિસ, ઉપરોક્ત સંબંધિત ખર્ચા, વેચાણ પાછળ થયેલ ખર્ચની તેની લેવાની નીકળતી રકમ વસૂલી શકે છે અને ત્યારપછી જો કોઈ પુરાંત ઉપલબ્ધ હોય અથવા સામાન બાકી રહે તો બેંક તે ભાડુઆતને આ સામાન તેમનાં નોંધણીકૃત સરનામા પર પાર્સલ દ્વારા અથવા અન્ય કોઈ જવાબદાર માધ્યમો મારફત કે પછી વેચી રકમ પેઓર્ડર અથવા ડીમાન્ડ મારફત ભાડુઆતને તેના/તેણીના જોખમે અને જવાબદારીએ મોકલાવી શકે છે અથવા તે અન્ય કોઈ લૉકરમાં કે જગ્યાએ ચૂકવવાપાત્ર ભાડાં સાથે અથવા ખાતામાં કોઈ ચૂકવવાપાત્ર વ્યાજ વગર બેંકને યોગ્ય લાગે તેમ પોતાની પાસે જ રાખી શકે છે. જો લૉકર એકથી વધુ વર્ષ સુધી ખોલવામાં ન આવે તો બેંક તેની સંપૂર્ણ મુનસફીએ લૉકરની ફાળવણી રદ કરી શકે છે અને લૉકર ખોલી શકે છે, ભલે પછી તેનું ભાડું નિયમિત ચૂકવવામાં આવ્યું હોય.
17. બંને માંથી કોઈ પણ પક્ષકાર ભાડાંની સહમતિ સાધેલ મુદત રદ થવાની તારીખથી ત્રીસ દિવસ અગાઉ આ કારાર રદ કરવાના ઇરાદાની લેખિત સૂચના અન્ય પક્ષકારને આપીને આ કારાર રદ કરી શકે છે અને ભાડુઆત લૉકરની ગ્રાહકની ચાવી સૂચનાની સમાપ્તિની તારીખના દિવસે અથવા પહેલા બેંકને સોંપી દેશે. કારાર રદ કરવાના કિસ્સામાં ભાડુઆતે પહેલા જ ચૂકવી દીધેલા એડવાન્સ ભાડાંનું રીફંડ બેંક દ્વારા નહીં આપવામાં આવે.
18. જો ઉપર જણાવ્યા મુજબની કોઈ સૂચના આપવામાં ન આવી હોય અને ભાડુઆત દ્વારા ગ્રાહક ચાવી પાછી ન સોંપવામાં આવી હોય તો બેંકના વિકલ્પે ભાડાંની મંજૂરી મુદતની સમાપ્તિ તારીખ પછી લૉકર ફરી ભાડે આપવામાં આવી શકે છે પરંતુ આ શરત આ દરમિયાન બેંકના જમા થયેલા અધિકારો સામે પૂર્વાગ્રહ વિના લાગુ રહે છે.
19. કોઈ અગત્યના કારણ અથવા તાત્કાલિક આવશ્યકતા ઊભી થવા પર બેંક તેને જરૂરી સમજે એ મુદત સુધી વૉલ્ટ બંધ કરવાનો અધિકાર અનાધિત રાખે છે અને ભાડુઆતને કોઈ સૂચના આપ્યા વગર લૉકરનો ઉપયોગ કરવાની મનાઈ કરી શકે છે અથવા ભાડુઆતને લૉકર માંથી તાત્કાલિક સામાન કાઢી લેવા કહી શકે છે અને જો આ જોગવાઈનું પાલન ન કરવામાં આવે તો તેને લીધે થતા નુકસાન માટે ભાડુઆત જવાબદાર રહેશે.
20. લૉકરના ઉપયોગ દરમિયાન વૉલ્ટના દરવાજા અથવા લૉક ખરાબ થઈ જવાને લીધે થતા કોઈ વિલંબના પરિણામ સ્વરૂપ થયેલા કોઈ નુકસાન અથવા હાનિ માટે બેંક જવાબદાર નહીં રહે.
21. બેંક ન્યાયાલયના આદેશનો અમલ કરતા અથવા ન્યાયી પ્રક્રિયા દ્વારા તેને અપાયેલા અધિકારો અંતર્ગત તેની સંપૂર્ણ મુનસફીએ લૉકર તોડી શકે/ઇન્વેન્ડરી લઈ શકે અને/અથવા લૉકર તેમ જ તેમાં રહેલા સામાનનો કબજો કોઈ અન્ય વ્યક્તિ/ઓને સોંપી શકે છે અને આ કિસ્સામાં લૉકરમાં રહેલા સામાનના કોઈ નુકસાન અથવા હાનિ થવા પર બેંક જવાબદાર નહીં રહે.
22. ભાડુઆતના સરનામામાં થતા કોઈ ફેરફારની સૂચના બેંકને ભાડુઆત એ વિના વિલંબે લેખિતમાં આપવાની રહેશે તથા બેંક દ્વારા કોઈ પત્રવ્યવહારની સૂચના ભાડુઆતને બેંકની બુક્સમાં નોંધાયેલા તેમના રજિસ્ટર્ડ સરનામા પર ટપાલ દ્વારા મોકલેલ હોય તેને યોગ્ય રીતે બજવણી કરેલ માનવામાં આવશે.
23. આ કારારની ચાલુ મુદત દરમિયાન લૉકરમાં રહેલા સામાનના થતા કોઈ નુકસાન અથવા હાનિ માટે જવાબદાર નહીં રહે જે વરસાદ, આગ, પૂર, ભૂકંપ, વીજળી પડવી, સામાજિક બળવો, ચુક્ર, રમખાણ કે પછી અન્ય કોઈ કારણ/છો કે જે બેંકના નિયંત્રણમાં ન હોય તેને લીધે થયેલ હોય તથા ભાડુઆત દ્વારા કોઈ સામાન લૉકરની બહાર રાખી મૂકવાથી તેમને થતા કોઈ નુકસાન માટે પણ બેંક જવાબદાર નહીં રહે.
24. એ સ્પષ્ટ સમજવામાં આવ્યું છે કે બેંક અને ભાડુઆત વચ્ચેનો સંબંધ ભાડુઆત અને માલિકનો છે નહીં કે બેંક અને ગ્રાહકનો.
25. લૉકરમાં રહેલી બધી જ સંપત્તિ ભાડુઆત તરફથી બેંકને ચૂકવવાના રહેતા દરેક નાણાં સામે જનરલ લીયેનને આધીન પ્રાપ્ત કરવામાં અને જાળવવામાં આવે છે અને બેંક તેને લેવાની નીકળતા પરંતુ ન ચૂકવેલા નાણાંની પૂર્તિ કરવા આ સંપત્તિ અથવા તેનો હિસ્સો વેચવાનો અધિકાર ધરાવે છે.
26. બેંક દ્વારા તેની સંપૂર્ણ મુનસફીએ યોગ્ય મનાય એ રીતે સામાન્ય સાવચેતીના એ બંધાં જ પગલાં લેવામાં આવશે ત્યારે લૉકરમાં જમા કરેલ સામાનને થતા કોઈ નુકસાન અથવા હાનિ માટે બેંક કોઈ જ જવાબદારી અથવા ઉત્તરદાયિત્વ સ્વીકારતી નથી. એ જ રીતે, ભાડુઆતને તેમના હિતમાં બેંક સાથેના લૉકરમાં જમા કરેલ મૂલ્યવાન સામાનનો વીમો કરાવવાની સલાહ આપવામાં આવે છે.
27. બેંક દ્વારા વખતો વખત આલેખિત કરાતા તેમ જ લૉકર ભાડે આપવા અપનાવવામાં આવતા નિયમો અને નિયમનોનું પાલન કરવા ભાડુઆત સહમત થાય છે.
28. ભાડુઆત બેંકને શતિપૂર્તિ પૂરી પાડશે તથા ભાડુઆત દ્વારા કોઈ નિયમ અને શરતનું ઉલ્લંઘન કરવાને લીધે થઈ શકતા કોઈ નુકસાન, હાનિ, લાગત, ખર્ચ, કૃત્યો, કાર્યવાહી સામે બેંકને હરહંમેશ શતિપૂર્તિ પૂરી પાડી સુરક્ષિત રાખશે.
29. આ કારાર અંતર્ગત ઊભી થતી દરેક બાબતો, મુદ્દાઓ તેમ જ લૉકર ભાડે રાખવાના હેતુસર આ કારાર હેઠળના પક્ષકારો ભારત, મહારાષ્ટ્રમાં મુંબઈ ન્યાયાલયના ન્યાયાલયને આધીન રહે છે.
30. બેંક લૉકર ફાળવવા સમયે તેની સંપૂર્ણ મુનસફીએ લૉકરના ભાડાં પેટે એકલ ભાડુઆત પાસેથી સલામતી તરીકે ફિક્સડ ડિપોઝિટ મેળવી શકે છે. સંયુક્ત ભાડુઆત દ્વારા લૉકરનું ભાડું ન ચૂકવવા પર બેંક આ ફિક્સડ ડિપોઝિટ પર લીયેન રાખવાનો અને સેટ આઈ કરવાનો અધિકાર રહેશે.
31. અમે સ્વીકૃત કરીએ છીએ કે અમે આ કારારની એક પ્રત મેળવી છે.

માત્ર કાર્યાલયના ઉપયોગ માટે

પ્રાપ્ત કરેલ પ્રોટેટા ભાડું (રૂ)	પ્રાપ્ત તારીખ :	અધિકૃત અને પ્રમાણિતકર્તા	એસડીબી નંબર	સહી(ઓ) ચકાસનાર (અધાશરો) :	લૉકર કરરોડિયનનું નામ, સહી અને એમ્પ. કોડ	બ્રાન્ચ મેનેજર/બૉક્સ અપનું નામ, સહી અને એમ્પ. કોડ
	સીપીયુ પર મોકલ્યું :					